



સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા

સકલ વેલ્યુઝની સામે, અથરાજ બંજોડ પાછળ, પ્રેપોઝિટ રોડ
પ્રહલાદનગર ગાર્ડન પાસે, પ્રહલાદનગર, અમદાવાદ ૩૮૦ ૦૧૫
ફોન: (૦૭૯) ૨૬૯૧ ૯૯૦૦ ફેક્સ: (૦૭૯) ૨૬૯૧ ૯૯૪૫
www.spipa.gujarat.gov.in

યુપીએસસી સિવિલ સર્વિસીઝ પ્રિલિમ પાસ કર્યેથી મળવાપાત્ર પ્રોત્સાહન સહાય તથા મુખ્ય પરીક્ષાનાં તાલીમવર્ગ બાબત

સ્પીપા, અમદાવાદ દ્વારા ગુજરાત કોમર્સ કોલેજ, અમદાવાદ ખાતેના યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા ૨૦૧૮ માં સફળ થયેલા ઉમેદવારો માટે યુ.પી.એસ.સી. ધ્વારા તા.૨૮-૦૮-૨૦૧૮ થી યોજનાર સીવીલ સર્વિસીઝ (IAS, IPS, IFS etc.) ની મુખ્ય પરીક્ષા માટેની તૈયારી સારૂ તાલીમવર્ગ વિનામૂલ્યે શરૂ કરવામાં આવેલ છે, જે ઉમેદવાર ઉક્ત તાલીમવર્ગમાં જોડાવવા માંગે છે તેવા ઉમેદવારોએ તાલીમ અને લાયબ્રેરી ડીપોઝીટ પેટે રૂ.૩૨૦૦/- (ત્રીફેરબલ) “**SPIPA DEPOSIT AHMEDABAD**” ના નામના ડીમાન્ડ ડ્રાફ્ટ ધ્વારા ચૂકવવાના રહેશે. તાલીમ, મોક ટેસ્ટ, લાયબ્રેરી, ૨૪ કલાક રીડીંગરૂમની સવલત વિનામૂલ્યે આપવામાં આવશે, અને તા.૨૩/૭/૨૦૧૮ થી તેમાં જોડાઈ શકશે.

યુ.પી.એસ.સી. દ્વારા માહે જૂન-૨૦૧૮માં લેવાયેલ યુપીએસસી સીવીલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવાર કે જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ૧ લી ઓગષ્ટ ૨૦૧૮ પહેલા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો આ તાલીમવર્ગમાં જોડાઈ શકશે. મુખ્ય પરીક્ષા અંગેની ઉક્ત જણાવેલ સવલતોનો લાભ લેવા ઈચ્છતા હોય, તેવા ઉમેદવારોએ spipa.upsc@gmail.com પર આધાર પુરાવા સહિતની વિગત ઈ-મેઈલ દ્વારા આ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૭ માં મોકલી આપવાની રહેશે.

વધુમાં, યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર દ્વારા યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા ૨૦૧૮ માં સફળ થયેલ ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર પ્રોત્સાહન સહાય સ્પીપા ધ્વારા આપવામાં આવશે. (પુરૂષ ઉમેદવારોને રૂ.૨૫,૦૦૦/- અને મહિલા ઉમેદવારોને રૂ.૩૦,૦૦૦/-) જે લાભાર્થીઓએ ઉક્ત સહાય મેળવવાની હોય તે લાભાર્થીઓએ <https://digitalgujarat.gov.in/> પર Student Corner – Scholarship માં જઈ, Search online services માં Prelim લખીને GO પર ક્લિક કરવાથી “For Candidates who have cleared Prelim Examination of Civil Services Examination conducted by UPSC & selected for Mains Examination” યોજનાના નામ પર ક્લિક કરવાથી Instruction મેનુ ખુલશે તેમાં Apply Online પર ક્લિક કરવાથી Citizen login માટેની નવી વિંડોમાં Click For New Registration (For Citizen) પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તે કર્યા બાદ Citizen login માં login થઈ, ઓનલાઈન અરજી તથા જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી તા.૨૩-૦૭-૨૦૧૮ થી તા.૧૦-૦૮-૨૦૧૮ સુધીમાં (રાત્રે ૧૧.૫૮ કલાક સુધીમાં) કરવાની રહેશે. જે કર્યા બાદ સ્ટાઈપેન્ડ અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તા.૧૦-૦૮-૨૦૧૮ બાદ કોઈ ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

sd/-

નાયબ મહાનિદેશક

સ્પીપા, અમદાવાદ.

ક્રમાંક: સીસપ-તાલીમ/૨૦૧૮-૧૮/મુખ્ય પરીક્ષા-તાલીમવર્ગ/૦૫/સ્ટડી